



## “ગુજરાતના ઐતિહાસિક લેખો”

પુસ્તકમાં ગંભીર સખલનાયો

લેખક:—શ્રીયુત પણ લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંહિર, વડોદરા.

૬

કૃષ્ણસ ગુજરાતી સભા, મુખ્ય તરફથી તેની અંથાવલિના નં. ૧૫ તરીકે ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’ નામનું જે પુસ્તક ઉં આગોમાં પ્રકાશિત થયેલું છે અને જેના સંગ્રહ કરવાનાર એડીટર તરીકે આચાર્ય ગિરજનાનંકર વદ્વલભજી ખી. એ; એમ. આર. એ. એ. એ. નિવૃત્ત કયુરેટર, આર્કિવીલોજિકલ વિભાગ, પ્રિન્સ એન્ડ વેલ્સ મ્યુઝિયમ, મુખ્ય-એમનું નામ નોડાયેલું છે—તે સંબંધમાં વાચ્યકાતું લક્ષ્ય પેંચવા ધ્રણ્યું છું.

ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો જે અન્યત્ર અંગેણ પરિચય-ભાષાંતર સાથે કે તે વિના પ્રકાશિત થયા હતા, તેનો એકત્ર સંગ્રહ ગુજરાતી પરિચય-ભાષાંતર સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં કરવામાં આવ્યો છે; એથી ઈતિહાસપ્રેમીઓને—ગુજરાતના અભ્યાસીઓને—આનંદ થવા જોઈએ; પરંતુ તેનું આંતર નિરીક્ષણ કરતાં વિષાદ થાય એવું વિરોધ જણાય છે. એમાં ડેટલેટ રથ્યે અક્ષમ્ય વિચિત્ર ગંભીર ભૂદ્વલરેલા અથેં કરવામાં આવ્યા છે અને અશુક્ષિકીઓની પરંપરા છે. એથી ઈતિહાસના અભ્યાસીઓને અને અન્ય વાચકાને ગેરસમજ થની સંભવિત છે. તથા તેનો પ્રવાહ અન્યત્ર આગળ વધે એ શક્ય છે. એથી એ સંબંધમાં આહીં થોડું સૂચન કરવાતું ઉચ્ચિત ધાર્યું છે. આશા છે કે સત્ય-પ્રેમીઓ તટસ્થ દિશિથી એનું અવલોકન કરશે.

ઉપર્યુક્ત પુસ્તકનો ત્રીજો ભાગ, જે સંવત ૧૯૬૮માં સન ૧૯૪૨માં પ્રકટ થયેલ છે, તેમાંના માત્ર એક પહેલા લેખ સંબંધમાં જ અહીં વક્તાન્ય શક્ય છે. ત્યાં ‘વાદેલા વંશના લેખો’ એવા મથાળા નીચે ‘આખુગરિ ઉપર દેલવાડાનો રાજ વિરધનલના સમયનો શિલાલેખ’ જેને નં. ૨૦૬ તરીકે ઓળખાવેલ છે અને ‘પ્રા. સં. ઈ. બા. પા. ૧૭૪’ સંસાથી અન્યત્ર પ્રસિદ્ધ જણાનેલ છે તે લેખ, પહેલાં લાવનગર રાજ્યના પુરાતન સંશોધન-ખાતા તરફથી પ્રકાશિત થયેલા ‘કલેક્શન એન્ડ પ્રાઇસ એડ્ડ સંકૃત ઈન્સ્કેપશન્સ’ નામના પુસ્તકમાં પ્રકટ થયેલ હતો. ( જે પુસ્તક અત્યારે મારી સામે નથી. )

પૂર્વીકિત “ગુજરાતના ઐતિહાસિક લેખો” પુસ્તકના ત્રીજ ભાગમાં એ શિલાલેખનો પ્રાથમિક પરિચય કરાવતો જણાવ્યું છે કે—“આખુગરિલવાડાના રાજીઓના પ્રધાનો વસ્તુપાદ અને તેજપાદ નામના એ ભાઈઓએ આહિનાથના મંહિરમાં કેટલુંક સમારકામ તથા સુધારો કરાવ્યાતું લેખમાં લખ્યું છે.”

એવી રીતે પરિચય કરાવતાં લેખકે એ લેખનો આશય સમજવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં શોચનીય અનભિસત્તા દર્શાવી છે, એમ કહેવું જોઈએ. કારણું કે એ લેખ ( શ્લો. ૬૦-૬૧ )નો આશય સમજનારા સુજોતે સમજય તેમ છે કે મંત્રીશ્વર તેજપાલે આખૂર્વત્ત ઉપર હેઠલવાડામાં ‘લૂણસિંહવસંહિકા’ એ નામનું નેમિનાથહેવતુઃ વિશાળ નાનું જે જિનમંદિર તૈયાર કરવાયું હતું, જે ( પર ) દેવકુલિકાઓથી અલંકૃત અને વિશાળ હરિત-શાલાથી શોખતું રચાવ્યું હતું, તેનું એ શિલાલેખમાં વર્ણન છે. એ સંબંધમાં ગૂર્જરિક્ષરના માન્ય પુરાહિત કવિ સોમેશ્વરહેવે ૧૪ કાખ્યોવાળા રયેલી પ્રશાસ્ત શિલાલેખમાં ઉત્કીર્ણ કરેલી છે.

ઉપર્યુક્ત પરિચયમાં, મૂળ સંસ્કૃત લેખમાં અને તેના ગુજરાતી ભાષાંતરમાં એ લેખનો સંવત ૧૨૬૭-ઈ સન ૧૨૧૧ જાણવેલ છે, પરંતુ એવી સાથેના બીજા લેખના આધારે અને અન્ય સાધનો દ્વારા તપાસ કરતાં ત્યાં વાસ્તવિક સંવત ૧૨૮૭ સમજવો જોઈએ. તથા અંતમાં ‘શ્રીનાગેદગચ્છે શ્રીવિજયસેનસ્થૂરિમિઃ પ્રતિષ્ઠા કૃતા’ અસ્પષ્ટ પણ ત્યાં વંચાય છે, તે હેઠાં જોઈએ.

ઉપર્યુક્ત પુસ્તકમાં મૂળ સંસ્કૃત લેખ જે પંક્તિઅઙ્ગ છ્યાયો છે, તેમાં હુસ્વ દીર્ઘ, પદ્ધાંછેદ, પદ-પોજના, પૃથક્કરણ આદિ કરવામાં યથાયોગ્ય કુશલતા અને કાળજી દર્શાવી જણાતી નથી, જેને પરિચયમે તેમાં અનેક ભૂલો જણાય છે. દિશેખનામોમાં અને અન્યત્ર પણ વર્ણું-વ્યત્યય, વર્ણ-લોપ જેવી અસ્ત-વ્યરતતા નજરે ચેડે છે. તેમાંથી કેટલીક દર્શાવી શકાય.

શુદ્ધ	અશુદ્ધ
શ્લો. ડમાં અણાહલપુર	જોઈએ, ત્યાં અણહિપુર છ્યાયેલું છે.
” ૪માં કલ્પદ્રમ	” ” કલ્પદ્રમ ”
” ૭માં અશ્વરાજઃ	” ” સશ્વરાજઃ ”
” ૧૪માં વિરચ્ચયતિ	” ” વિરચ્ચયતિ ”
” ૧૭માં સાકુ માકુ ધનદેવી	” ” સાકુ માકુ વનદેવી ”
” ” સૌદર્યઃ	” ” સૌદર્યઃ ”
” ૪૫માં જૈત્રસિહઃ	” ” ચૈત્રસિહઃ ”
” ૪૮માં -ગુરુ-	” ” -ગુહ-
” ૪૯માં અનુપમાદેવ્યાઃ	” ” અનુપદેવ્યાઃ ”
” ૫૮માં સુકૃતવેદ્મ	” ” સુકૃતવેશ ”
” ૬૩માં મયતાં	” ” મતયો ”
” ” દશ-મૂર્ત્યઃ	” ” દશ-પુત્રયઃ ( ? ) ”
” ૬૪માં મૂર્ત્તીનામિહ	” ” મુદ્રનીનામિવ ”
” ” કરિવધૂપુષ્ટ-	” ” કરિદધુઃ સ્વેષ-
” ” -બન્ધુઃ	” ” -બાહુઃ ”
” ૬૬માં પ્રાન્દા-	” ” પ્રાચંદા-
” ૭૦માં શ્રીજૈનશાસનવની	” ” શ્રીજૈનશાસનવની ”
” ” ખચ્ચક	” ” ખચ્ચક ”

—એ લેખનું ભાષાંતર જોઈએ, તો તે પણ યથાયોગ્ય સંતોષકારક લાગતું નથી, અનેક ભૂલોથી બરેખું જણાય છે. તેમાં અશ્વરાજ જોઈ એ ત્યાં શાશ્વરાજ ( શ્લો. ૭-૮માં ) છે, કુમાર કાર્તીકીયસ્વામીની માતા પાર્વતી જોઈ એ, ત્યાં કાર્તીવીર્યની માતા જણાવેલ છે ( શ્લો. ૭ ), ચંડુપ્રસાદ જોઈ એ ત્યાં ચંડુપ્રસાદ અને પ્રબ્લાન જોઈ એ, ત્યાં પ્રલભાણ વગેરે જોવા મળે છે.

તેમાં મંગલાચરણનો ખીજે શ્લોક, તેના ભાષાંતર સાથે વિચારવા યોગ્ય છે.

‘ ય: [ક્ષ]ાંતિમાનપ્રયર[ણ:] પ્રકોપે શાંતોપિ દીપ્તઃ સ્મરનિપ્રહાય ।

નિમીલિતાક્ષોપિ સમગ્રદર્શી સ વ: શિવાયાસ્તુ શિવાતનૂજઃ ॥ ”

તેનું ત્યાનું ભાષાંતર— “ શાંતિમાન હોવા છતાં ડોપથો રહેત, શાંત હોવા છતાં સ્મરનિપ્રહમાં પ્રદીપેત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે પાર્વતીનો પુત્ર ગણુપતિ તમારું કલ્યાણુ કરો. ”

—આ સ્થળે શિવા-તનૂજનો અર્થ નેમિનાથદેવ કરવો સુસંગત છે, કારણુકે આ પ્રશ્નરિત, નેમિનાથદેવના નવા બનાવેલા જિતભંહિરને ઉદ્દેશી રચાયેલી છે, નેમિનાથની માતાતું નામ શિવા ( શિવાહેની ) નૈતસાહિત્યમાં પ્રચિદ્ધ છે, નેમિનાથ ક્ષમાવાન હોવા છતાં ડોપ પ્રત્યે અરુણ ( લાલ-ડોપ દૂર કરનાર ), શાંત હોવા છતાં કામેદેવનો નિપ્રહ કરવામાં દીપ્ત ( ઉચ્ચ ) કઢી શક્કાય, ધ્યાન-મગ્નાવસ્થામાં તે નિમીલિતાક્ષ હોય છે, છતાં તેઓ સર્વજ્ઞ હોઈ સમગ્રદર્શી છે, તે શિવા-તનૂજ નેમિનાથ તમારા શિવ-મંગલ, કલ્યાણ, મોક્ષ ભાટે હોય.

—કવિએ અહીં વિરોધાલંકારથી અનેકાંતવાદ ઘટાવી દુચર્થી શખનો પ્રેરોગ કરી ખૂબીથી નેમિનાથદેવનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે એ લક્ષ્યમાં લેવું જોઈ એ.

ઉપર્યુક્ત પુસ્તકમાં છપાયેલું ૧૭મું કાબ્ય અને તેનું ભાષાંતર જોવા જોવું છે:—

“ જાલદ્રમાકુસાકુવનદેવીસોહગાવયજુકાખ્યા: ।

પદમલદેવી ચૈંબાં કમાદિમાઃ સપ્ત સૌંદર્યઃ ॥ ”

તથા ત્યાં તેનું ભાષાંતર આ પ્રમાણે છપાયેલું છે—

“ તેને જલ્દી, માઙુ, સાઙુ, વનદેવી, સોહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમનાળી સાત પરણેલી પત્નીએ હતી. ”

—ઉપરના શ્લોકમાં લાણુગ, ભદ્રદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ચાર ભાઈએનાં નામો જણાવેલા છે, એમને એ અનુક્રમે ૭ સર્વી-સહેદર બહેનો હતી, તેને અહીં ભાતાંતરકારે અર્થનો અનર્થ કરી પરણેલી પત્નીએ જણાવી છે !!

મૂળ શિવાલેખમાં પહેલી ચાર બહેનોનાં જલ્દી, માઙુ, સાઙુ, વનદેવિ એવાં નામો વંચાય છે, તેને બદ્લે ઉપર્યુક્ત પુસ્તકમાં ઉપર જણાયા પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં, તથા તેના ભાષાંતરમાં જલ્દી, માઙુ, સાઙુ, વનદેવી એવાં નામો છપાયેલાં છે.

વિરોધમાં મૂળ શિવાલેખમાં સોદર્યઃ પાઠ છે, તે એડીટરને શુદ્ધ તરીકે સમજનો જણાતો નથી એટલે ત્યાં સૌંદર્યઃ છપાયું લાગે છે; એડીટરે ત્યાં સુંદરી શખનું સમજું

તેનું એવું ૩૫ કલ્પી લીધું લાગે છે. એથી તેનો અર્થ તેવો વિચિત્ર કણો લાગે છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ત્યાં સોર્ડ્યઃ પાઠ શુદ્ધ છે, સોદરી ( સહેદરી-સગીખેન અર્થ-વાચક ) શણનું બહુવચનનું એ ૩૫ છે. કવિએ એ પહેલાં એણાં પદ દ્વારા પૂર્વે જણાવેલા ચાર અંધુએ ( ૧ લૂણિગ, ૨ મલનદેવ, ૩ વર્ષતુપાલ અને ૪ તેજપાલ ) એમની અનુક્રમે જણાવેલી આ જ સહેદરી-સગીખેનો હતી, તેમ જણાયું છે.

વિશેષ તપાસ કરતાં જણાય છે કે મંત્રીશ્વર તેજપાલે ત્યાં આખૂ તીર્થમાં પોતે કરાવેલ 'લૂણસીહ-વસહી' નામના નેમિનાથદેવના તે ચૈત્યમાં, જગતીમાં પોતાની એ સાતે ખેણેનોના એમ માટે પણ જુદા જુદા ૭ તીર્થંકરની પ્રતિમાઓથી અલંકૃત જુદી જુદી જ દેવકુલિકાઓ કરાવી હતી અને સં. ૧૨૬૩ વર્ષના ચૈત્ર વદ્દ ૮ શુક્રવારે નાગદ્રગંધના શ્રીવિજયસેનસૂર દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. શિલાદેખો સાથે હાલમાં પણ એ વિદ્યમાન છે, ત્યાં સ્પષ્ટ આવા ઉદ્દેખો છે—

—સ. ૧૨૯૨ વર્ષ ચૈત્રવદિ ૮ શુક્ર શ્રીઅર્દુદાચલતીર્થે સ્વયંકારિતલૂણસીહવસહિકાલ્ય-શ્રીનેમિનાથદેવચૈત્યે જગતાં.....મહ. શ્રીતેજઃપાલેન—

- (૧) સ્વમગિન્યા બાઇ જાહેનદેવ્યાઃ એયોર્ધર્થ.....
- (૨) „ ની „ માઉ „ „
- (૩) „ „ સાઉદેવ્યાઃ „ „
- (૪) „ „ ઘણદેવિ- „ „
- (૫) „ „ સોહગા- „ „
- (૬) „ „ વયજુકા- „ „
- (૭) „ „ પદલા- „ „.....

—આ શિલાદેખો 'એપિગ્રાફીઓ દંડિકા' વો. ૮, પૃ. ૨૨૭ થી ૨૨૮માં નં. ૨૬થી ૩૧માં, તથા 'પ્રાચીન જૈન લેખસંગ્રહ' ભાગ ભીજમાં લેખાંકિઃ ૬૪ થી ૬૮ અને ૧૦૩માં, અને 'અર્દુદ-પ્રાચીન જૈન લેખસંગ્રહ' ( આખૂ ભાગ ભીજ )માં લેખાંક ૩૨૫ થી ૩૨૮, ૩૩૦, ૩૩૧ અને ૩૩૭માં મૂળ સંસ્કૃતમાં પ્રકાશિત થયેલા છે; તથા પહેલામાં અંગ્રેજીમાં અને પાણીના એ અથેમાં તેનો ગુજરાતી સાર પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહીં વિશેષ સમર્થનની અપેક્ષા નથી.

વિશેષમાં એટલે અંશે સંતોષ માનીએ કે ઉપર્યુક્તા 'ગુજરાતના ઐતિહાસિક લેખો' ભાગ નીજમાં, સંગ્રહ કરનાર એડિટરે પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન ( પૃ. ૧૧ )માં 'વર્ષતુપાલ તથા તેજપાલનું વંશવક્ષ' દર્શાવ્યું છે, તેમાં ઉપર જણાવેલ નામોવાળી જ ખેણેનોને તેમની બહેનો તરીકેના કંમમાં દર્શાવી છે.

એના શ્લો. ૬૨ થી ૬૬ના ભાષાંતરમાં ( પૃ. ૧૨માં ) અર્થ ન સમજવાથી કંઈક વિચિત્ર જ જણાયું છે કે—

".....ધર્મકારોના પ્રમાણથી વાદળાંને પણ ન માચનાર.....ધીમત લાવણ્યસિંહ દિનાયકો સમાન હતા અને હુાથી પર આરોહણ કરી જિનેખરના દર્શને જતી તેમની ૧૦ ( ૬૧ ) પુત્રીએ રમ્ય લાગે છે.

સોલંકી નૃપ વીરધ્વવળના અતુલ કર જેવા વરસુપાલના સુમતિવાળા અતુજ તેજપાલે આ જિનના મંદ્રિમાં આ પુત્રોએનાં (?) હાથો પર વિરાજતાં પદ્ધતાનાં ૧૦ (૬૨) પુત્રણાં કરાયાં.

સરવર સમીપમાં ઇલસહિત આપ્રવસ્ત સમાન તેની પત્નીનો આધાર, તેજપાલ નિજ પત્નીસહિત વરસુપાલના મહેલમાં હેખાય છે.”

વાસ્તવિક રીતે ત્યાં આવો અર્થ જોઈએ— [ શ્રીમાન હ્યાંપના પુત્ર હ્યાંપ્રસાદ થયા, તેના પુત્ર ઉસોમ, તેના પુત્ર હ્યાંશ્વરાજ થયા. તેમના પવિત્ર આશયવાળા પુત્રો પલુણિગ, હ્યાંમલ્લદેવ, હ્યાંવરસુપાલ અને હ્યાંતેજપાલ થયા; જેઓ જિનમતર્પી આરામ (ખગીયા)ને ઉન્નત કરવામાં નીરદ-મેદ જેવા છે. ૬૨

શ્રીમંત્રીશ્વર વરસુપાલનો પુત્ર જૈત્રસિંહ<sup>૬૪</sup> નામનો, અને તેજપાલના પુત્ર લાવણ્ય-સિંહ<sup>૬૦</sup> વિશ્રુત વિષ્યાત મતિવાળો છે; હાથળુણોના રક્ષણ પર ચડેલી. એ દ્વાની મૂર્તિએ એવી રીતે લાંબા સમય સુધી શોખે છે કે-જાણે જિન-દર્શન માટે જતા દિગ્નાયકો (૧૦ દિક્ષાઓ)ની એ મૂર્તિએ હેઠાં ૬૩

ચૌલુક્ય ક્ષિતિપાલ વીરધ્વવળના અદ્વિતીય બંધુ અને વરસુપાલના અતુજ લધુભંધુ સુષુદ્ધિશાલી આ મંત્રો તેજપાલે અહીં હાથળુણોની પીડ પર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિએની પાણી તેમની (તે ઉપર જણુંદે ૧૦ની) કંતા-પત્નીએ સાથે દ્વારા મૂર્તિએ વિમલ ઉજનવલ અસ્મ (આરસ પાણાણ)ના ઘરટક (તાકા-ગોખલા)માં રહેલી કરાવી હતી. ૬૪

સંકલ્પ પ્રજનના ઉપજીવ્ય (આશ્રય કરવા યોગ્ય) વરસુપાલની પાસે તેજપાલ, સરો-વરની પાસે રહેલ સર્કણ (કણવાળા) સહકાર (આપ્રવસ્ત) જેવા શોખે છે. ૬૪

તે બંને બાઈએઓ (વરસુપાલે અને તેજપાલે) પ્રત્યેક પુર, ગામ, માર્ગ, પર્વત અને સ્થળમાં વાન, ઝૂલા, નિપાન (અવેદ), ઉદ્યાન, સરોવર, પ્રાસાદ (મંદિર), સત્ર (દાનશાલા-પરથ) વગેરે ધર્મસ્થાનોની પરંપરા અત્યંત નવી કરી અને જુર્ખું થઈ હતી, તેને ઉકૂત કરી; તેની સંખ્યા પણ જણું નથી, જે તે કોઈ જાણુંનું હોય તો તે પૃથ્વી જ જાણું છે. ૬૫

પુ. ૧૩માં પાણળના શ્લોકાના ભાષાંતરમાં આચારોનાં નામો વગેરેમાં બહુ ગોટાળો કર્યો છે. અનંદ, અમરસ્સરિને બંને ‘ચંદ્રામરસ્સરિ આય્યો,’ શ્રીવિજયસેનસરિને બંદ્દે એરૂ સુનિર્ધર હતો’ વિ. વિ. કેટલી ભૂલો અહીં જણુંની શકાય?

આ સંખ્યમાં વિશેષ જિજાસુ ઈતિહાસના અભ્યાસીએઓ તુલનાત્મક દિલ્લિથી નીચે જણુંદેલા અથે જેવા જોઈએ—

ભાવનગર રાજ્યના પુરાતત્વ સંશોધનખાતા તરફથી પ્રકાશિત ‘માનુષ સંસ્કૃત દેખ-સંશેષણમાં અંગ્રેજ ભાષાંતર સાથે પ્રકટ થયેલ સંસ્કૃત પ્રશાસ્ત્રવાળાઓ એ શિલાલેખ, ઉપર્યુક્ત ‘ગુજરાતના ઈતિહાસિક લેખો’ ભાગ ત્રીજમાં ગુજરાતી ભાષાંતર સાથે પ્રકટ થયેલ છે, તે ઉપરાંત બીજે પાંચ સ્થળે પ્રકાશિત થયેલ જાણુવામાં આવેલ છે—

(૧) ઈસ્ટીસન ૧૮૨૮માં 'એશિયાટિક રિસર્વીસ' વો. ૧૬માં (પૃ. ૩૦૨) એચ. એચ. વીલ્સને ઉપર્યુક્ત લેખનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રકટ કરાયું છે.

(૨) 'એપીઆફિયા ઇંડિયા' વો. ૮માં ડૉ. પ્રો. એચ લ્યુડસે "નેન ઈન્સિક્ટેશન્સ એટ ધી ટેમ્પલ એઝે નેમિનાથ એન માર્કિન્ટ આભૂ" એ હેડિંગ નીચે પૃ. ૨૦૦થી ૨૦૮ માં પરિચય આપ્યા પછી પૃ. ૨૦૮ થી ૨૧૩ માં ઉપર્યુક્ત મૂળ સંસ્કૃત શિલાલેખની ફોણે ક્રાપી જેડી છે અને તે સાથે ૩૨ લેખો અંગ્રેજ ભાષાંતર સાથે ત્યાં પ્રકટ કર્યા છે. (આ પુસ્તકનું ટાઈટલ ગયેલ હોવાથી પ્રકાશન સન દર્શાવી શકાતો નથી)

(૩) ઈસ્ટીસન ૧૮૮૩માં એપેને ગવેર્નર્મેન્ટ સેન્ટ્રલ ભૂક ડીપો દારા પ્રકટ થયેલી કંવિ સોમેશ્વરહેઠે ર્યેલી 'ડીર્ટિંક્સ્પુદ્ધી'ના પરિશિષ્ટ (A.)માં ઉપર્યુક્ત શિલાલેખને અંગ્રેજ ભાષાંતર સાથે એડીટર આભાજી કાથવટે દારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. (ત્યાં સંસ્કૃત લેખના અંતમાં સં. ૧૨૮૩ જાણવેલ છે, પરંતુ અંગ્રેજમાં સંવંત ૧૨૮૭ જાણવેલ છે.) તથા તેની સાથે સંબંધવાળો લાંબો ભીજો શિલાલેખ જે સં. ૧૨૮૭ વાળો છે, જેમાં તે ધર્મસ્થાનની રક્ષા, તથા ઉત્સવાદિ વ્યવસ્થા સૂચ્યવેલી છે, તે પણ ત્યાં પરિશિષ્ટ (B) માં દર્શાવેલ છે.

(૪) સંવંત ૧૯૭૮ ઈસ્ટીસન ૧૯૨૧ માં જૈન આત્માનંદ સભા, ભાવનગર દારા પ્રકટ થયેલ 'પ્રાચીન જૈન લેખસંગ્રહ' (ભાગ ભીજો) માં એ શિલાલેખ લે. ૬૪ તરીકે ગુજરાતી સાર સાથે સુપ્રેસિદ્ધ સાક્ષર શ્રીજિનવિજયજીના પ્રયત્નથી પ્રકટ થયેલ છે.

(૫) સંવંત ૧૯૭૪ માં શ્રીવિઘ્નધર્મસૂર્જિન અંથમાળા, ઉજનૈન તરફથી પ્રકટ થયેલ 'અભુદ્પ્રાચીન જૈન લેખસંગ્રહ' (અભૂ ભાગ ભીજો) એ પુસ્તકમાં ધર્તિહાસપ્રેભી સ્વ. સુનિરાજ જયંતવિજયજીના પ્રયત્નથી લે. ૨૫૦ તરીકે એ લેખ ગુજરાતી અવલોકન સાથે પ્રકાશિત થયેલ છે.

આશા છે કે-સત્ય સંરોધન-પ્રકાશનથી ગુજરાતનો સાચો ધર્તિહાસ પ્રકાશમાં આવશે, ત્યારે સર્વને આનંદ થશે.

સંવંત ૨૦૦૭ શ્રાવણ શુક્ર પંચમી }  
શ્રીનેમિનાથ-જન્મકલ્યાણુક }